

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination**March/April-2022(Old Course)****AUDITING AND CORPORATE GOVERNANCE - 1 (DISC. SPE. ELE -1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ A. ઓડીટીંગ એટલે શું? ઓડીટીંગના ફાયદા-મર્યાદાની ચર્ચા કરો. (૧૦)
B. ઓડીટ ટ્રેઇલ વિશે નોંધ લખો. (૧૦)

અથવા

- પ્રશ્ન.૧ A. ચાલુ ઓડીટ અને વાર્ષિક ઓડીટ વચ્ચેનો તફાવત જણાવો.
B. ઓડીટ કાર્યક્રમ એટલે શું? તે તૈયાર કરવા માટે ઓડીટરે કયા ખાસ મુદ્દાઓ લક્ષમાં લેવા જોઈએ?
- પ્રશ્ન.૨ A. આંતરીક અંકુશ એટલે શું? તેના ફાયદા-મર્યાદા જણાવો. (૧૦)
B. રોકડ વેચાણ અંગે આંતરીક અંકુશ પદ્ધતિ પર ચર્ચા કરો. (૧૦)

અથવા

- પ્રશ્ન.૨ A. વાઉચીંગ એટલે શું? વાઉચીંગ કરતી વખતે તમે કયા મુદ્દા ધ્યાનમાં લેશો?
B. નીચેનાનું વાઉચીંગ તમે કઈ રીતે કરશો? (ગમે તે બે)
1. મિલકત વેચાણની આવક 2. પગાર 3. પ્લાન્ટ ચંત્રો 4. ડિવીડન્ડ વ્યાજની આવક
- પ્રશ્ન.૩ ઓડીટરની લાયકાત, ગેરલાયકાત, નિમણૂક અને તેને દૂર કરવા અંગેની 2013ના કંપની ધારાની જોગવાઈઓ જણાવો. (૧૫)

અથવા

- પ્રશ્ન.૩ કંપની ઓડિટરના હક્કો અને ફરજો જણાવો.
પ્રશ્ન.૪ કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ અને હેતુ દર્શાવો. કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવેશ થતી બાબતો સમજાવો. (૧૫)

અથવા

- પ્રશ્ન.૪ કોર્પોરેટ ગવર્નન્સના સિધ્ધાંતો જણાવો.

ENGLISH VERSION

- Q-1 A. What is mean by Auditing? Discuss the advantage and disadvantage of auditing. (10)
B. Write a note on Audit Trial. (10)

OR

- Q-1 A. Difference between Continuous Audit & Annual Audit.
B. What is Audit Programme? Which special points Auditors should take into consideration while preparing it?
- Q-2 A. What is Internal Check? State its advantage and limitations. (10)
B. Suggest Internal Check? Discuss System for cash sales. (10)

OR

- Q-2 A. What is Vouching? Which point will you take into considerations while vouching?
B. How will you do the vouching of the following? (any two)
1. Income from sale of assets 2. Salary
3. Plant Machinery 4. Income from dividend & Interest
- Q-3 State the provision of Company Act, 2013 related to qualification, disqualification, appointment and removal of the Auditor. (15)

OR

- Q-3 State the rights and duties of Company Auditor.
Q-4 Give meaning and objectives of Corporate Governance. Explain the matters included in the Corporate Governance. (15)

OR

- Q-4 Explain the principle of Corporate Governance.
